

બં. અ. કૃષિ મહાવિદ્યાલય ખાતે ઇન્ડિયન સોસાયટી ઓફ સોઇલ સાયન્સ, આણંદ દ્વારા વર્લ્ડ સોઇલ ડે ની ઊજવણી કરવામાં આવી.

ઇન્ડિયન સોસાયટી ઓફ સોઇલ સાયન્સ, આણંદ ચેપ્ટર દ્વારા બં. અ. કૃષિ મહાવિદ્યાલયના અમૃત મહોત્સવની ઊજવણી વર્ષમાં ૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ કોલેજના ઓડિટોરીયમ ખાતે વર્લ્ડ સોઇલ ડે, ૨૦૨૧ની ઊજવણી કરવામાં આવી. જેના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં પોસ્ટરસ તૈયાર કરવાની હરીફાઈ અને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અધ્યક્ષ તરીકે આણંદ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત ઓર્ગેનિક યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરીયા, મુખ્ય મહેમાન તરીકે આકૃત્યુ ના સંશોધન નિયામકશ્રી અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી એવા ડૉ. એચ. બી. પટેલ, અતિથી વિશેષ ડૉ. વાય. એમ. શુક્લ, ડીન અને આચાર્ય તથા તજજ્ઞ વરિષ્ઠ વૈજ્ઞાનિકશ્રી ડૉ. અનિલ આર. ચિંન્યમાલાત્પુરે તથા સોસાયટીના આણંદ ચેપ્ટરના સર્વે પદાધિકારીઓ, ડીનશ્રી હોર્ટીકલ્ચર કોલેજ ડૉ. એન. આઇ. શાહ, ડીનશ્રી, એફ.પી.ટી. કોલેજ, ડૉ. આર. એફ. સુતાર સર્વે પ્રાધ્યાપકશ્રીઓ, ફેકલ્ટી સ્ટાફ અને વિભાગીય વડાઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સમારંભના અધ્યક્ષશ્રી ડૉ. કે. બે. કથીરીયા સાહેબે દર વર્ષે પાંચમી ડિસેમ્બરે યોજાતા વર્લ્ડ સોઇલ ડે ના થીમ “હોલ્ટ સોઇલ સલીનાઈઝેશન, બુસ્ટ સોઇલ પ્રોડક્ટીવિટી”ને વર્ણવતા જણાવ્યું કે આજના સમયે વધતી જતી ક્ષારીય જમીનને રોકવી જરૂરી છે અને તે ગુજરાતનો મોટો પ્રશ્ન છે. આપણે દરિયા કિનારો તેના લીધે સૂકો પ્રદેશ થઇ ગયો છે જે પહેલા લીલી નાગેર તરીકે જાણીતો હતો. આઝાદીના સમયથી ક્ષારીય જમીન અંગેનું સંશોધન કેન્દ્ર શરૂ થયેલ છે જેના દ્વારા આપણે કાર્ય કરતા રહ્યા છીએ છતાં, આજે જમીન નબળી થઇ ગઇ છે. વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર હરીફાઈમાં જે વિજેતા બન્યા છે તેમના પોસ્ટરો અને આપણી ચર્ચા ખેડૂતો સુધી પહોંચે તે માટે કૃષિ ગોવિદ્યા દ્વારા ખેડૂતોને પણ જાગૃત કરવા હાકલ કરી હતી.

મુખ્ય મહેમાન તરીકે ડૉ. એચ. બી. પટેલે પ્રાકૃતિક ખેતી અને કુદરતી સ્ત્રોતોના ઉપયોગ કરી ઉત્પાદકતા વધારવા અંગે છણાવટ કરી હતી. ખેડૂતોને આપણે નવી નવી જાતો આપી છતાં ખારાશનું પ્રમાણ વધી રહ્યું છે તેના પાયાના કારણો જણાવી તે નાબૂદ કરવા અંગે આજનો વિષય ખૂબ જ અગત્યનો છે તેમ જણાવ્યું હતું.

ડૉ. વી. પી. રામાણી જેઓ આ કાર્યક્રમના ઓર્ગેનાઇઝર સેક્રેટરી તરીકે સર્વનો આવકાર કરી કહ્યું કે જ્યાં જેવી ધરતી તેવા માણસો, જમીનના સ્વાસ્થ્યની સાથે માનવનું સ્વાસ્થ્ય ટકી રહેલું છે તે સમજાવતા સોસાયટી દ્વારા વર્ષો વર્ષ કરવામાં આવતા કાર્યક્રમ અને વિદ્યાર્થીઓ તથા ખેડૂતોને જાગૃત કરવામાં કેવો ભાગ ભજવી રહ્યા છે તેની જાણકારી આપી હતી.

બં. અ. કૃષિ મહાવિદ્યાલયના ડીનશ્રી ડૉ.વાય. એમ. શુક્લે ખાસ જણાવ્યું કે દર વર્ષે દસ ટકાના દરે જમીન ક્ષારીય થતી જાય છે જે ચિંતાનો વિષય છે. ખેડૂતો અને જમીન માટે વ્યાપક નુકશાન થાય છે અને વાતાવરણનો બગાડ થઈ રહ્યો છે તે માટે નવી ટેકનોલોજીનો સમન્વય કરી વધુ વિદ્યાર્થીઓને આ ભગીરથ કાર્યમાં જોડી કાર્ય કરવા ઉપર ભાર મુક્યો હતો.

આ પ્રસંગે સમગ્ર રાજ્યમાંથી સ્નાતક, અનુસ્નાતક અને પોલીટેકનીકના અંદાજે ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પોસ્ટરસ હરીફાઈમાં ભાગ લીધો હતો. જમીન ક્ષારીય થવાના કારણો ઉપર બનાવેલ પોસ્ટર વિશે ઓનલાઇન પ્રેઝન્ટેશન અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ હરીફાઈમાં વિજેતા થયેલા પ્રથમ, દ્વિતીય અને ત્રીજા સ્થાનિક અને રાજ્ય કક્ષાના વિજેતા વિદ્યાર્થીઓ હાજર હતા તેમને સ્મૃતિ ચિહ્ન આપી મહાનુંભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ડૉ. અનિલ આર. ચિન્યમાલાત્પુરે, વરિષ્ઠ વૈજ્ઞાનીકશ્રી, ક્ષારિય જમીન સુધારણા સંશોધન કેન્દ્ર, ભરૂચ દ્વારા જણાવવામાં આવ્યું કે આપણે આજે આ ઊજવણી શા માટે કરીએ છીએ? ખાસ સમજવું પડશે કે જમીન આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના નથી, આપણી જમીન તંદુરસ્ત અને સારી હશે તોજ આપણું જીવન ખુશહાલ અને તંદુરસ્ત હશે. ગુજરાતમાં જમીનની ક્ષારીય બાબતો અંગે થયેલા વિવિધ સંશોધનોની તલસ્પર્શી માહિતી આપી હતી અને આપણી સામે રહેલા પડકારો અને તકો અંગે સૌને વાકેફ કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. સંદિપ રાઠોડપરમારે કર્યું હતું. જ્યારે આભાર વિધિ સોઇલ સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપક અને વડા, ડૉ. એન. જે. જાદવે કરી કાર્યક્રમ સંપ્ન કર્યો હતો.



